

B.Com. Semester - 3 (CBCS) Examination
Oct/Nov - 2023 [NEW COURSE]
Corporate Accounting - 1(Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ ગોવિંદ કં. લિ. નું 31-03-2022 ના રોજનું કાચુ સરવૈયું

(૨૦)

ઉધારબાકીઓ	રકમ રૂ.	જમાબાકીઓ	રકમ રૂ.
ખરીદી	11,16,000	12% ની પ્રેફરન્સ શેરમૂડી	1,80,000
ઉત્પાદન ખર્ચા	1,08,000	ઇક્વિટી શેરમૂડી બહાર પાડેલ	7,20,000
વેચેલ માલ પરત	48,000	10% ના રિડિમેબલ ડિબેન્ચર	1,80,000
દેવાદારો	2,40,000	વેચાણ	19,20,000
પ્લાન્ટ	3,60,000	લેણદારો	1,20,000
જમીન-મકાન	4,80,000	ખરીદમાલ પરત	36,000
શરૂ સ્ટોક	84,000	રોકાણોનું વ્યાજ	9,600
વહીવટી અને વેચાણ ખર્ચા	1,26,000	ડિરેક્ટરની લોન	24,000
મજૂરી	4,17,600	શેરજાતી ખાતુ	12,000
વાહનો	72,000	સામાન્ય અનામત	84,000
માર્ગસ્થ માલ	19,200	દેવીહુંડીઓ	12,000
ડિબેન્ચર વ્યાજ	7,200	સ્ટાફ પેન્શન ફંડ	9,600
રોકાણો	1,80,000	બાંધી મુદતની થાપણો	28,800
લેણી હુંડીઓ	24,000	નફા-નુકશાન ખાતું (1-4-2021)	36,000
ડિબેન્ચર વટાવ	48,000		
રોકડ અને બેંક	30,000		
ડિરેક્ટર ફિ	12,000		
	33,72,000		33,72,000

⇒ વધારાની માહિતી :-

- 1) રોકાણો પર મળવાનું બાકી વ્યાજ રૂ. 8,400 છે.
- 2) આખર સ્ટોકની કિંમત રૂ. 1,68,000 આકવામાં આવી છે.
- 3) દેવાદારો પર 10% ધાવખાધ અનામતની જોગવાઈ કરો.
- 4) જમીન મકાન પર 5%, પ્લાન્ટ પર 10% અને વાહનો પર 20% ઘસારો ગણો.
- 5) કરવેરાની જોગવાઈ નફાના 30% લેખે કરવાની છે.
- 6) સામાન્ય અનામત ખાતે ચોખ્ખા નફાના 10% રકમ લઈ જવાની છે.
- 7) ડિરેક્ટરોએ ઇક્વિટી શેરમૂડી પર 10% ડિવિડન્ડની ભલામણ કરી છે.
- 8) ડિબેન્ચર વટાવ રૂ. 8,000 માંડીવાળીને બાકીનો વટાવ બિનચાલુ મિલકત તરીકે દર્શાવો.
- 9) કંપનીની સત્તાવાર મૂડી 9,000 ઇક્વિટી શેર દરેક રૂ. 100 નો અને 12% ના 1,800 પ્રેફરન્સ શેર દરેક રૂ. 100 ની બનેલી છે.

⇒ ઉપરોક્ત માહિતી પરથી કંપનીધારા 2013 અનુસાર ઉભા સ્વરૂપે કંપનીનાં વાર્ષિક હિસાબો તૈયાર કરો.

અથવા

પ્રશ્ન. ૧ રાધા લિ. નાં ચોપડે 31-3-2022 ના રોજ નીચે પ્રમાણે બાકીઓ હતી.

ઉધારબાકીઓ	રકમ રૂ.	જમાબાકીઓ	રકમ રૂ.
જમીન-મકાન	5,95,000	ઈકવીટી શેરમૂડી	7,00,000
સાંચા-યંત્રો	4,02,500	7.5% ની પ્રેક્. શેર મૂડી	3,50,000
ફર્નિચર	1,12,000	સામાન્ય અનામત	3,15,000
રોકાણો	5,79,950	મૂડી અનામત	1,92,500
ડિબેનચર પરતનિધીના રોકાણો	70,000	શેર જપ્તી ખાતુ	15,750
છૂટા ઓજારો	42,000	જમીનગીરી પ્રિમિયમ	57,750
દેવાદારો	2,31,000	5% ના ડિબેનચર્સ	1,75,000
ઉત્પાદક મજૂરી	1,23,200	પ્રોવિડન્ટ ફંડ	45,500
પ્રાથમિક ખર્ચા	21,000	લેણદારો	1,15,500
ઈકવીટી શેરના બાકી હપ્તા	35,000	બેંકલોન	88,900
શરૂનો સ્ટોક	1,16,550	રોકાણોની આવક	33,250
આવકવેરો	98,000	જાહેર થાપણો	51,100
રોકડ અને બેંક	37,800	ડિબેનચર પરતનીધી	70,000
પગાર	1,99,500	ઘાલખાધ અનામત	10,500
ભાડુ, કરવેરા	70,000	નફા-નુકશાન ખાતુ	19,250
તાર-ટપાલ	22,750	વેચાણ	9,10,000
પ્રોવિડન્ટ ફંડમાં ફાળો	8,750		
ખરીદી	3,72,750		
ડિરેક્ટર ફિ	12,250		
	31,50,000		31,50,000

- 1) સામાન્ય અનામત ખાતે રૂ. 87,500 લઈ જાઓ.
- 2) દેવાદારો પર 5% લેખે ઘાલખાધ અનામત રાખો.
- 3) તા. 31-3-2022 ના રોજ સ્ટોક રૂ. 3,33,900 છે.
- 4) પ્રાથમિક ખર્ચા માંડીવાળો
- 5) ખર્ચના બાકી દેવા: પગાર રૂ. 10,500, તાર ટપાલ રૂ. 5250, ઉત્પાદક મજૂરી રૂ. 8,750
- 6) અગાઉથી ચૂકવેલ ભાડુ રૂ. 7,000 છે.
- 7) ફર્નિચર પર 5%, સાંચા-યંત્રો પર 2% અને જમીન-મકાન પર 4% ઘસારો ગણો.
- 8) સંચાલકોએ ઈકવીટી શેરમૂડી પર 10% ડિવિડન્ડ અને પ્રેક્. શેરમૂડી પર 7.5% ડિવિડન્ડની ભલામણ કરી છે.
⇒ ઉપરોક્ત વિગતો પરથી 2013 ના કંપનીધારાની જોગવાઈ મુજબ કંપનીના ઉભા સ્વરૂપે વાર્ષિક હિસાબો તૈયાર કરો.

પ્રશ્ન. ૨ તા. 31-3-2022 ના રોજનું જય લિ. નું પાર્કુ સરવૈયું નીચે મુજબ છે.

(૨૦)

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
ઈ.શેરમૂડી 20,000 શેર દરેક રૂ. 10 નો	2,00,000	પ્લાન્ટ-મશીનરી	1,80,000
10,000, 6% ના રિડિમેબલ પ્રેક્. શેર દરેક રૂ. 10 નો	1,00,000	ફર્નિચર	60,000
		રોકાણો	60,000
નફા-નુકશાન ખાતુ	1,50,000	સ્ટોક	50,000
7.5% ના ડિબેનચર્સ	50,000	દેવાદારો	1,00,000
લેણદારો	30,000	રોકડ/બેંક સિલક	80,000
	5,30,000		5,30,000

⇒ 1-4-2022 ના રોજ

1. રોકાણો રૂ. 75,000 માં વેચવામાં આવ્યા હતા.
2. ડિબેન્ટર્સ 5% ના પ્રીમિયમ પરત કર્યા.
3. પ્લાન્ટ-મશીનરીનું પુનઃમૂલ્યાંકન રૂ. 2,50,000 માં કરવામાં આવ્યું.
4. મૂડી પરત અનામતમાંથી દરેક 4 ઇક્વિટી શેરદિઠ 1 બોનસ શેર આપવામાં આવ્યો.
5. રિડિમેબલ પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમ પરત કરવામાં આવ્યા.

⇒ કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો અને રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કર્યા પછીનું પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન. ૨ વિજય લિ. નું 31-3-2022 ના રોજનું પાકું સરવૈયું

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
1,20,000 ઇક્વિટી શેર દરેક રૂ. 10 ના એવા શેરદિઠ રૂ.8 ભરપાઈ	9,60,000	કાયમી મિલકતો	16,00,000
14% ના 1,00,000 રિડિમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂ.10 ના એવા શેરદિઠ રૂ.9 ભરપાઈ	9,00,000	રોકાણો	5,50,000
સામાન્ય અનામત	4,50,000	બેંક સિલક	4,00,000
નફા-નુકશાન ખાતું	2,80,000	અન્ય ચાલુ મિલકતો	4,50,000
જમીનગીરી પ્રીમિયમ	60,000		
લેણદારો	3,50,000		
	30,00,000		30,00,000

⇒ કંપનીધારાની જરૂરી જોગવાઈઓનું પાલન કર્યા બાદ રિડિમેબલ પ્રેફરન્સ શેર 10% ના પ્રીમિયમ પરત કરવાના છે. ધંધામાં બેંક સિલક રૂ. 3,00,000 રાખવાની છે. બધાજ રોકાણો રૂ. 5,00,000 માં વેચી દેવામાં આવ્યા કંપનીએ જરૂરી સંખ્યામાં દરેક રૂ. 100 ની મૂળ કિંમતના નવા 15% ના ક્યુમ્યુલેટીવ પ્રેફરન્સ શેર બહાર પાડવાનું નક્કી કર્યું. રિડિમેબલ પ્રેફરન્સ શેરધારકોને પૂર્ણ ચૂકવણુ થઈ ગયેલ છે.

⇒ રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરતા ઉદ્ભવતી મુડી પરત અનામતનો ઉપયોગ ઇક્વિટી શેર પુર્ણ ભરપાઈ કરવા માટે તેમજ 03 ઇક્વિટી શેરદીઠ 01 બોનસ શેર આપવા માટે કરવાનો છે. ઉપરોક્ત બાબત અંગે વિજય લિ. ના ચોપડે જરૂરી આમનોંધ લખો અને પાકું સરવૈયું તૈયાર કરો.

પ્રશ્ન. ૩ અમન લિ. નું તા.31-3- 2022 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

(૧૫)

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
3,000 ઇક્વિટી શેર દરેક રૂ.100 ના પુર્ણ ભરપાઈ	3,00,000	દ્રશ્ય મિલકતો 2,00,000 બાદ: ઘસારો 40,000	1,60,000
રૂ. 100 નો એક એવા 3,000 8%ના ક્યૂ.પ્રેફ. શેર પુર્ણ ભરપાઈ	3,00,000	સાંચા-યંત્રો 4,00,000 બાદ: ઘસારો 80,000	3,20,000
જમીનગીરી પ્રીમિયમ	1,00,000	પાઘડી	35,000
લેણદારો	1,25,500	પેટન્ટ્સ	45,000
		સ્ટોક	8,000
		દેવાદારો	72,500
		પ્રાથમિક ખર્ચા	45,000
		નફા-નુકશાન ખાતું	1,40,000
	8,25,500		8,25,500

⇒ મૂડીઘટાડાની નિચે મુજબની યોજના ટ્રિબ્યુનલે મંજૂર કરી.

- 1) ઇક્વિટી શેર પર રૂ. 90 ઘટાડવા.
- 2) દરેક પ્રેફરન્સ શેર રૂ. 90 સુધી ઘટાડવા.
- 3) પ્રેફરન્સ શેર પર બે વર્ષનું ડિવિડન્ડ બાકી છે. તે માટે દરેક રૂ. 100 ના બદલામાં નવા ઇક્વિટી શેર દરેક રૂ. 100 ના એવા 5% ભરપાઈ કિંમત ગણી આપવા.
- 4) જે ખરેખર દેવું નથી તેવી જમા બાકીઓ, જે ખરેખર લેણું નથી તેવી ઉધાર બાકીઓ અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવી.

- 5) ઉપર મુજબ માંડી વાળતા કઈ બાકી રહેતો વધારામાંથી કાયમી મિલકતો તેની ચોપડે કિંમતના પ્રમાણમાં માંડી વાળવી.
 ⇒ ઉપરોક્ત વિગતોનાં આધારે જરૂરી આમનોંધ લખો અને ફેરફાર બાદનું પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૩ ચમન લિ. નું તા. 31-3-2022 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
દરેક રૂ. 10 ના તેવા ઈકવીટી શેર	2,00,000	મકાન	1,62,500
પ્રેક્ષરન્સ શેર દરેક રૂ. 10 ના તેવા	50,000	મશીનરી	62,500
10% ના ડિબેન્ચર્સ	50,000	ટેકનિકલ નો-હાઉ(Know-How)	25,000
લેણદારો	50,000	ફ્રેન્ચાઈઝી	37,500
દેવીહૂંડી	30,000	જાહેરાત ઝુંબેશ ખર્ચ	70,000
કરવેરાની જોગવાઈ	50,000	સ્ટોક	62,500
		દેવાદારો	10,000
	4,30,000		4,30,000

⇒ નીચે મુજબની યોજના મૂડી ઘટાડા માટે કોર્ટ દ્વારા મંજૂર કરાઈ.

- 1) ઈકવીટી શેરમૂડી શેરદીઠ રૂ. 5 થી ઘટાડવી.
 - 2) પ્રેક્ષરન્સ શેરમૂડી રૂ. 25,000 સુધી રદ કરવી.
 - 3) ડિબેન્ચર હોલ્ડર્સ તેઓનું દેવું રૂ. 25,000 થી જતુ કરવા તૈયાર થયા છે.
 - 4) લેણદારો રૂ. 25,000 જતા કરવા તૈયાર છે.
 - 5) સ્થિર મિલકતોની 90% થી પુનઃ આકારણી કરવી.
 - 6) બધીજ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી.
- ⇒ કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. અને યોજના અમલમાં મૂક્યા પછીનું પાકું સરવૈયું તૈયાર કરો.

પ્રશ્ન.૪ X લિ. નું તા. 31-12-2022 નાં રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે.

(૧૫)

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
રૂ. 100 ના એક એવા 2500 શેર,શેરદીઠ રૂ. 75 ભરપાઈ	1,87,500	જમીન-મકાન	2,50,000
રૂ. 100 ના એક એવા 6% ના 5,000 પૂરા ભરપાઈ પ્રેક્ષરન્સ શેર	5,00,000	પ્લાન્ટ-મશીનરી	6,25,000
રૂ. 100 ના એક એવા 7,500 ઈકવીટી શેર શેરદીઠ રૂ. 60 ભરપાઈ	4,50,000	પેટન્ટ્સ	1,00,000
5% ના ગીરો ડિબેન્ચર્સ	2,50,000	સ્ટોક	1,37,500
ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ	12,500	દેવાદારો	2,75,000
લેણદારો	3,62,500	રોકડ	75,000
		નફા-નુકશાન ખાતું	3,00,000
	17,62,500		17,62,500

⇒ લિક્વિડેટરને મિલકત વેચાણની ઉપજના 3% લેખે અને પસંદગી સિવાયના બિનસલામત લેણદારોને ચૂકવેલ રકમના 2% લેખે વેતન આપવાનું છે. મિલકતોના નીચે પ્રમાણે ઉપજ્યા

જમીન-મકાન	રૂ. 3,00,000
સ્ટોક	રૂ. 1,50,000
પ્લાન્ટ-મશીનરી	રૂ. 5,00,000
દેવાદારો	રૂ. 2,00,000
પેટન્ટ્સ	રૂ. 75,000

⇒ વિસર્જન ખર્ચ રૂ. 27,250 થયો. લેણદારોમાં પસંદગીના લેણદારો રૂ. 37,500 અને જમીન મકાનના તારણ પર ગીરો લોન રૂ. 1,25,000 ના સમાવેશ થાય છે. પ્રેક્ષર.શેર પર છેલ્લા ૨ વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે.

⇒ લિક્વિડેટરનું છેવટનું આવક-જવકનું પત્રક બનાવો.

પ્રશ્ન.૪ Y લિમિટેડ તા. 31-3-2022 ના રોજ સ્વૈચ્છિક દુડયામાં ગઈ અને તે તારીખે તેના ચોપડામાં નીચેની બાકીઓ હતી.

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
4,000, 10% ના પ્રેફરન્સ શેર દરેક રૂ.100 નો પુરા ભરાયેલા	4,00,000	જમીન-મકાન	2,00,000
20,000 ઈકવીટી શેર રૂ. 10 નો એક એવા રૂ. 8 ભરાયેલા	1,60,000	પ્લાન્ટ મશીનરી	5,00,000
60,000 ઈકવીટી શેર રૂ. 10 ના એક એવા રૂ. 6 ભરાયેલ	3,60,000	સ્ટોક	1,00,000
8% ના ડિબેન્ચર્સ (બધી મિલકતોના તારણ સામે)	2,00,000	દેવાદારો	2,66,000
ડિબેન્ચર પર ચડેલ વ્યાજ	16,000	રોકડ	60,000
બેંક ઓવરડ્રાફ્ટ	80,000	નફા-તુકશાન ખાતુ	3,20,000
લેણદારો	1,60,000		
સરકારી કર ચૂકવવાનો બાકી (પાછલા 12 માસનો)	10,000		
કામદારોનું વેતન અને પગાર	60,000		
	14,46,000		14,46,000

⇒ લિક્વિડેટર તેણે ઉપજાવેલી મિલકતોની ચોખ્ખી ઉપજના 5% (મિલકતની ઉપજ બાદ બેંક ઓવરડ્રાફ્ટની ચૂકવણી) અને પસંદગીના લેણદારો સિવાયના બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમના 1% લેખે કમિશન મેળવવા હકદાર છે.

⇒ બેંક ઓવરડ્રાફ્ટ જમીન-મકાન સામે સુરક્ષિત છે. અને તેના રૂ. 2,00,000 ઉપજ્યા. બાકીની મિલકતોની નીચે મુજબ ઉપજ થઈ.

પ્લાન્ટ મશીનરી રૂ. 4,00,000

સ્ટોક રૂ. 1,20,000

દેવાદારો રૂ. 1,80,000

⇒ લિક્વિડેશન ખર્ચ રૂ. 31,400 થયો.

⇒ લિક્વિડેટરે બધી જ મિલકતો તા. 1-4-2022 ના રોજ વેચી દિધી અને જવાબદારીઓ તેજ દિવસે ચૂકવી દિધી.

⇒ પ્રેફરન્સ શેર પર બે વર્ષનું ડિવિડન્ડ ચૂકવાયું નથી.

લિક્વિડેટરનું છેવટના હિસાબોનું પત્રક તૈયાર કરો.

ENGLISH VERSION

Q.1 The following is the trial balance of Govind company ltd as on 31-03-2022.

(20)

Debit balance	Rs.	Credit balance	Rs.
Purchases	11,16,000	12% pref. share capital	1,80,000
Production expenses	1,08,000	Equity share capital issued	7,20,000
Sales return	48,000	10% redeemable Debentures	1,80,000
Debtors	2,40,000	Sales	19,20,000
Plant	3,60,000	Creditors	1,20,000
Land & building	4,80,000	Purchase return	36,000
Opening stock	84,000	Interest on investments	9,600
Admin & selling expenses	1,26,000	Directors loan	24,000
Labour	4,17,600	Share forfeiture a/c	12,000
Vehicles	72,000	General reserve	84,000
Goods-in-transit	19,200	Bills payable	12,000
Interest on debentures	7,200	Staff pension fund	9,600
Investments	1,80,000	Fixed deposits	28,800
Bills receivables	24,000	Profit and loss a/c (1-4-2021)	36,000
Discount-on debentures	48,000		
Cash and bank	30,000		
Directors fees	12,000		
	33,72,000		33,72,000

additional information:-

- 1) Interest receivable on investments is rs. 8,400
- 2) Closing stock is valued at rs. 1,68,000
- 3) Provide bad debts reserve on debtors at 10%
- 4) Depreciate land and building by 5%, plant by 10% and vehicles by 20%
- 5) Make provision for taxation at 30% of profit
- 6) Transfer 10% of net profit to general reserve
- 7) The directors have proposed 10% dividend on equity share capital
- 8) Write off rs. 8,000 of debentures discount and remaining amount is to be shown as non-current assets.
- 9) The authorized capital of company is 9,000 equity shares of rs.100 each and 12% 1,800 preference shares of rs. 100 each.

From the above particulars, prepare final accounts of the company in vertical format as per schedule of company act-2013.

OR

Q.1 Following are the balances of Radha company limited as on 31-3-2022.

Debits balance	Rs.	Credit balance	Rs.
Land & building	5,95,000	Equity share capital	7,00,000
Plant & machinery	4,02,500	7.5% pref. share Capital	3,50,000
Furniture	1,12,000	General reserve	3,15,000
Investments	5,79,950	Capital reserve	1,92,500
Investment of deb. Red. fund	70,000	Share forfeiture a/c	15,750
Spare parts	42,000	Securities premium	57,750
Debtors	2,31,000	5% debentures	1,75,000
Productive wages	1,23,200	Provident fund	45,500
Preliminary expenses	21,000	Creditors	1,15,500
Calls-in-arrears on Equity Share	35,000	Bank loan	88,900
Opening stock	1,16,550	Income from investments	33,250
Income tax	98,000	Public deposits	51,100
Cash and bank	37,800	Debenture Redemption Fund	70,000
Salaries	1,99,500	Bad debts reserve	10,500
Rent and taxes	70,000	Profit & loss a/c	19,250
Postage & telegrams	22,750	Sales	9,10,000
Contribution to provident fund	8,750		
Purchases	3,72,750		
Director fees	12,250		
	31,50,000		31,50,000

⇒ Adjustments :-

1. Transfer rs. 87,500 to general reserve
2. Provide 5% reserve for bad debts on debtors.
3. Stock on 31-3-2022 was rs. 3,33,900
4. Write off preliminary expenses.
5. Outstanding expenses:- salaries rs. 10,500, postage-telegram rs. 5,250, productive wages rs. 8,750
6. Prepaid rent amounted to rs. 7,000
7. Provide depreciation on furniture at 5%, on plant & machinery at 2% and on land building at 4%
8. The directors of the company recommended 10% dividend on equity share capital and 7.5% dividend on preference share capital.

From the above particulars Prepare Final Accounts of the company in Vertical format as per schedule of company act-2013.

Q.2 The following is the balance sheet of jay ltd as on 31-03-2022.

Liabilities	Rs.	Assets	Rs.
20,000 equity shares of rs.10 each	2,00,000	Plant-machinery	1,80,000
10,000, 6% redeemable Pref. shares of rs.10 each	1,00,000	Furniture	60,000
Profit & loss a/c	1,50,000	Investments	60,000
7.5% debentures	50,000	Stock	50,000
Creditors	30,000	Debtors	1,00,000
		Cash & bank balance	80,000
	5,30,000		5,30,000

(20)

On 1-4-2022

1. The investments were sold for rs. 75,000
2. The debentures were redeemed at a premium of 5%.
3. Plant and machinery had been revalued at rs. 2,50,000
4. Out of capital redemption reserve, one share being issued as bonus for every 04 equity shares held.
5. The redeemable preference shares were redeemed at a premium of 10%

Write necessary journal entries and prepare the balance sheet after redemption.

OR

Q.2 Balance sheet of vijay ltd as on 31-3-2022.

Liabilities	Rs.	Assets	Rs.
1,20,000 equity shares of rs.10 each, rs.8 paid up per share	9,60,000	Fixed assets	16,00,000
1,00,000, 14% redeemable Pref. shares of rs.10 each, rs.9 paid up	9,00,000	Investments	5,50,000
General reserve	4,50,000	Bank balance	4,00,000
Profit & loss a/c	2,80,000	Other current assets	4,50,000
Securities premium	60,000		
Creditors	3,50,000		
	30,00,000		30,00,000

- ⇒ Redeemable preference shares are to be redeemed at 10% premium after making necessary provision as per companies act. Bank balance in the business is to be retained at rs.3,00,000 all the investments were sold for rs. 5,00,000 the company has decided to issue 15% cum. Preference shares of rs. 100 face value in adequate number. Redeemable pref. share holders were paid in full.

- ⇒ The reserve arising from redemption of redeemable pref. shares is to be utilized to make equity shares fully paid and to issue of 01 bonus shares for every 03 equity shares held.

Write journal entries and prepare balance sheet in the book of vijay ltd.

Q.3 Balance sheet of Aman ltd. as on 31-3-2022

(15)

Liabilities	Rs.	Assets	Rs.
3,000 equity shares of rs.100 each fully paid up	3,00,000	Tangible assets 2,00,000 Less:- Depreciation 40,000	1,60,000
3,000, 8% cum. Pref. shares of rs.100 each fully paid up	3,00,000	Plant & machinery 4,00,000 Less:-Depreciation 80,000	3,20,000
Securities premium	1,00,000	Goodwill	35,000
Creditors	1,25,000	Patents	45,000
		Stock	8,000
		Debtors	72,500
		Preliminary expenses	45,000
		Profit & loss a/c	1,40,000
	8,25,500		8,25,500

a scheme of capital reduction as approved by the tribunal was as follows:

1. Each equity share will be reduced by rs. 90
2. Each preference share will be reduced to rs. 90
3. In lieu of two years arrear of pref. shares dividend equity shares of rs. 100 each should be given as 5% paid up for rs.100 each.
4. Every credit balance which is not liability and every debit balance which is not asset and intangible assets are to be written off.
5. Any balance remaining in capital reduction fund account will be utilized to reduce fixed assets in the proportion of their book value.

Write Necessary journal entries and prepare balance sheet after implementation of scheme.

OR

Q.3 Balance sheet of chaman ltd. as on 31-3-2022 is give below.

Liability	Rs.	Assets	Rs.
Equity shares of rs. 10 each	2,00,000	Buildings	1,62,500
Preference share of rs. 10 each	50,000	Machinery	62,500
10% debentures	50,000	Technical know-how	25,000
Creditors	50,000	Franchisee	37,500
Bills payable	30,000	Advertisement campaign Exp.	70,000
Provision for Taxation	50,000	Stock	62,500
		Debtors	10,000
	4,30,000		4,30,000

⇒ A scheme of capital reduction as mentioned below was approved by court.

1. Equity share capital is reduced by rs. 5 per share
2. Pref. share capital is to eliminate to rs. 25,000
3. Debenture holders are agreed to waive their debt. By rs. 25,000
4. Creditors are ready to forgo rs. 25,000
5. Fixed assets are revalued at 90%
6. All intangible and fictitious assets are to be written off.

You are required to write journal entries in the books of the company and prepare balance sheet after giving effects of capital reduction.

Q.4 The balance sheet of X ltd as on 31-3-2022 was as follows.

(15)

Liability	Rs.	Assets	Rs.
2,500 equity shares of rs.100 each, rs. 75 paid per share	1,87,500	Land & building	2,50,000
5,000, 6% pref. shares of rs. 100 each fully paid	5,00,000	Plant & machinery	6,25,000
7,500 equity shares of rs.100 each, rs. 60 paid per share	4,50,000	Patents	1,00,000
5% mortgage debentures	2,50,000	Stock	1,37,500
Outstanding interest on debentures	12,500	Debtors	2,75,000
Creditors	3,62,500	Cash	75,000
		Profit & loss a/c	3,00,000
	17,62,500		17,62,500

The liquidator is entitled to get remuneration of 3% on assets realized and 2% on amount distributed to unsecured creditors other than preferential creditors.

The assets realized as follows.

Land & building	Rs. 3,00,000	Debtors	Rs. 2,00,000
Stock	Rs. 1,50,000	Patents	Rs. 75,000
Machinery & plant	Rs. 5,00,000		

The expenses of liquidation amounted to rs. 27,250. creditors include preferential creditors of Rs. 37,500 and Mortgage Loan of rs. 1,25,000 secured on land & building. The preference dividend were in arrears for two years.

prepare liquidators final statement of accounts.

OR

Q.4 Y ltd went into voluntary liquidation on 31-3-2022.

The balance in its books on that date were:

Liability	Rs.	Assets	Rs.
4,000 10% preference shares of rs.100 each fully paid	4,00,000	Land & building	2,00,000
20,000 equity shares of rs.10 each rs.8 paid up.	1,60,000	Plant & machinery	5,00,000
60,000 equity shares of rs.10 each, rs.6 paid up.	3,60,000	Stock	1,00,000
8% debentures (secured by a floating charge on all assets)	2,00,000	Debtors	2,66,000
Interest due on debentures	16,000	Cash	60,000
Bank overdraft	80,000	Profit & loss a/c	3,20,000
Creditors	1,60,000		
Taxes due on govt. within 12 months	10,000		
Worker's Wages and Salary	60,000		
	14,46,000		14,46,000

⇒ The liquidator is entitled to get remuneration of 5% on net. Amount of all assets realised (assets realised less bank overdraft paid) and 1% on the amount distributed to unsecured creditors other than preferential creditors.

⇒ Bank overdraft is secured by deposit of title deed of land & building which realised rs.2,00,000. Other assets realised the following Amount.

Plant & machinery	4,00,000
Stock	1,20,000
Debtors	1,80,000

⇒ Liquidation expenses were rs.31,400.

⇒ Liquidator realizes all assets on 1-4-2022 and discharged his obligations on the same date.

⇒ Dividend on preference shares were in arrears for two years.

Prepare liquidators final statement of account.
